

## M.Com Sem-4 Examination

507

## Operation Research

Time : 2-00 Hours]

July 2021

[Max. Marks : 50]

સૂચના : (1) જમણી તરફના અંક જ તે પ્રશ્નનો ગુણ દર્શાવે છે.

(2) વિભાગ-૧માંથી ગમે તે બે પ્રશ્નોના જવાબ લખો. વિભાગ-૨માંથી ગમે તે પાંચ પ્રશ્નોના જવાબ લખો.

Q.1 (a) કાર્યાલય સિરીઝની વ્યાપક રીતે તેના લક્ષ્યો

એને ORની કંઈપુરી ફરજાવો.

(10)

(b) નોંધો આપેલા ટાળાને શૈલ્પિકની અદદારી (1) ગુરુ - લઘુ કિફાઈ

(2) ગુરુ - ગુરુ સિદ્ધાંત (3) બાસલાસના સિદ્ધાંત અનુસાર

ક્રીએ મુદ્દુ પરિણ કરો. તેમજ EMV અને EVPI અંગઠો. (10)

એટની સિદ્ધાંત	સિદ્ધાંત	C <sub>યુદ્ધ</sub>			
		A <sub>1</sub>	A <sub>2</sub>	A <sub>3</sub>	A <sub>4</sub>
S <sub>1</sub>	0.20	37	17	22	47
S <sub>2</sub>	0.35	22	47	9	12
S <sub>3</sub>	0.30	17	22	47	9
S <sub>4</sub>	0.15	57	37	17	22

Q.2 (a) નિયુક્તિની સમર્થાના રૂપીલ આંદો હંગેરિયન પત્રની સમજાવો. (10)

(b) નીચેની પરિપ્રેક્ષાની સમર્થાના રીટાનમાં રૂપીલ મેળવો. (10)

પ્રાપ્તિકાણ

	P <sub>1</sub>	P <sub>2</sub>	P <sub>3</sub>	P <sub>4</sub>	યુદ્ધ
O <sub>1</sub>	8	15	12	17	25
O <sub>2</sub>	18	22	16	11	25
O <sub>3</sub>	10	14	16	20	20
માન	19	21	20	10	70

P.T.O.

Q.3 (a) સાત કાર્યોનું ને ચંકો પર કરવા માટે લાગી હોય અમલની આદ્યતી નીચે ખૂબ છે.

કાર્ય	A	B	C	D	E	F	G
ચંક - M <sub>1</sub>	6	18	17	8	12	13	11
ચંક - M <sub>2</sub>	10	12	14	10	18	3	5

તો પરથી કાર્યોનું આદેનો નિર્મ નક્કી કરી કુલ વ્યાનામ અમલ નક્કી કરો. જિંને ચંકો પર નવરાશનો અમલ ઘડા એવા.

(b) સરકારના શિક્ષણનો ઉપયોગ કરી નીચેની રૂમાંની ઉક્ખા એવા.

ઉક્ખા - A	ઉક્ખા - B		
	I	II	III
I	9	-12	5
II	2	-4	-2
III	8	9	1

Q.4 (a) નીચેની ચોજના માટે પર નકશો તૈયાર કરો ચાલુ ગુણ દર્શાવું માટે EST, EFT, LST, LFT અને CFT કરો.

પ્રકૃતિ	1-2	1-3	2-4	2-5	3-5	3-6	4-7	5-7	6-8	7-8
સમય (t <sub>e</sub> )	9	6	4	5	8	5	9	7	9	12

(b) નીચે એક પોર્ટફોની આદ્યતી આપેલ છે.

પ્રકૃતિ	1-2	2-3	2-4	3-5	3-6	4-5	5-6
આધ્યાત્મિક સમય	1	1	2	1	2	2	2
સૌથી વધુ સંલિપ્ત સમય	1	1	5	4	5	5	2
નિરાશાબાધી સમય	7	1	8	7	14	8	8

- (1) આ પોર્ટફોન માટે PERT નો નકશો કરો.
- (2) દર્શાવું કાર્ય માટે અંદાજિત સમય અને તેજુ વિભાગાનો.
- (3) આ પોર્ટફોન કાર્ય કરતાં 2 રૂપાં વહેલો પૂરો ચાલુ તેજી સંલાપન એવા.

[Prob (Z=1) આગામ 0.3413]

- SECTION - II ગુરૂત્વાક્ષર (10)
- Q.5 જીવોના અનુભોગના ફ્રાંચ હોયો. (કોઈ પણ ધોરણ) (10)
- (1) શીલાળાં પર અંદરથી મિક્રો જ્ઞાનો
  - (2) એ કોઈ રોક વ્યૂહ મારે રિસિડ આંડ ઇન્સ્ટાન્સો ને અનુરૂપ અખારી પઠાડ અનુભોગે 4, -5, 10 વાગે 20 હોય ત્થા આજીવાદી અલોગામનો સ્ટોર ડે = 0. 64 હોય, તો તે વ્યૂહ મારે હોવિયાના સિસ્ટમ્સની અપેક્ષા પઠાડ મેળવો.
  - (3) દર કેવી રીત ઓરલે હું? સિમલેક્શનની રીતમાં તેણું મદ્દાપ સમજાવો.
  - (4) વાર્દન વ્યવહારની સમસ્યામાં નિહાળા ઓરલે હું?
  - (5) ક્રાંત રંગો પર ન કરો કરાં મારેની નિમત્તાના સિસ્ટમાની સમસ્યાના દર્શાવ ઉકેલના જાહેર મારેની જરૂરી કાર્યાલાય જ્ઞાનોવો.
  - (6) રમાનો ઉકેલ અનુભાવ મારેની જે રીતના નામ લખો.
  - (7) વાર્દન વ્યવહારની સમસ્યાના મુલાકૃત પ્રાચી ઉકેલ મેળવાની મીતોના નામ જ્ઞાનોવો.
  - (8) 112 આંદોલની કોઈ પણ પ્રવૃત્તિનો અપેક્ષા સમય હોયદાનું સુધી જ્ઞાનો.
  - (9) રમાના સિસ્ટમના સંદર્ભમાં પલાંચાચ રિંગ પિંચો ઝૂફમાં અમજાવો.
  - (10) વાર્દન વ્યવહારની સમસ્યા જાને નિયુક્ટિની સમસ્યા હોયોનો પદ્ધતિપત્ર જ્ઞાનોવો.

Q.1(a) Explain Operations Research. Write its

characteristics and working of OR. (10)

(b) Determine the best act for the following pay-off matrix by applying (1) Maxi-min principle (2) Maxi-max principle (3) Laplace principle. Also find the value of EMV and EVPI.

Event	Probability	Act				(10)
		A <sub>1</sub>	A <sub>2</sub>	A <sub>3</sub>	A <sub>4</sub>	
S <sub>1</sub>	0.20	37	17	22	47	
S <sub>2</sub>	0.35		22	47	9	12
S <sub>3</sub>	0.30		17	22	47	9
S <sub>4</sub>	0.15		57	37	17	22

Q.2(a) Explain Hungarian method for solving an assignment problem. (10)

(b) Obtain the optimum solution to the following transportation problem. (10)

		Destinations				Supply
Origins		P <sub>1</sub>	P <sub>2</sub>	P <sub>3</sub>	P <sub>4</sub>	
O <sub>1</sub>	8	15	12	17	25	
O <sub>2</sub>	18	22	16	11	25	
O <sub>3</sub>	10	14	16	20	20	
Demand	19	21	20	10	70	

Q.3(a) The data of time for 7 jobs on two machines is given as under:

Job	A	B	C	D	E	F	G
Machine- M <sub>1</sub>	6	18	17	8	12	13	11
Machine- M <sub>2</sub>	10	12	14	10	18	3	6

Determine the sequence of the jobs and total minimum time. Also calculate the idle time on two machines. (10)

(b) Solve the following game using dominance principle. (10)

		Player-B		
		I	II	III
Player-A	I	9	-12	5
	II	2	-4	-2
	III	8	9	1

Q.4(a) Prepare a PERT chart for the following project. Determine EST, EFT, LST, LFT and float time (FT) for each activity. (10)

Activity	1-2	1-3	2-4	2-5	3-5	3-6	4-7	5-7	6-8	7-8
Time (te)	9	8	4	5	8	5	9	7	9	12

(b) Consider a project below:

Activity	1-2	2-3	2-4	3-5	3-6	4-5	5-6
Optimistic time	1	1	2	1	2	2	2
Most likely time	1	1	5	4	5	5	2
Pessimistic time	7	1	8	7	14	8	8

(1) Construct a PERT chart of this project. (10)

(2) Determine the expected time for each activity of the project and its variance.

(3) What is the probability of completing the project 2 days earlier than expected?

$$[\text{Prob}(z=1) = 0.3413]$$

- Q.5 Answer in brief (any five) M083A-6 max-2  
Classification based on behaviour. (10)
- (1) State the types of Classification based on behaviour.
  - (2) If for a strategy different pay-offs under four events are respectively 8, -5, 10 and 20 and its coefficient of optimism  $\alpha = 0.6$ , find the expected pay-off for the strategy by Horwitz's principle.
  - (3) What is an slack variable? Explain its importance in Simplex method.
  - (4) What is degeneracy in Transportation problem?
  - (5) State the conditions for the optimum solution to the sequencing problem with  $n$  jobs on three machines.
  - (6) Write down the name of two methods for solving problem of game theory.
  - (7) Give the name of methods for obtaining basic feasible solution of transportation problem.
  - (8) Give a formula to determine expected time of any PERT activity.
  - (9) Explain the saddle point in the context of game theory.
  - (10) State the difference between transportation problem and Assignment problem.
-